



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૪/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૪ કેસ કરી, ૭૫ વ્યક્તિઓને ઝડપી, ૧૯૨ લીટર દેશી દારૂ, ૨૫૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૫૫ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૫૦,૬૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૫૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૨૩/૧૯

વસ્ત્રાપુર: જવલંત હરીશકુમાર પંડ્યા (રહે. હરીકૃપા સોસાયટી કઠવાડા રોડ નરોડા) એ તા.૭/૪/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે આરોપી જે.કે. કોઈલ કોટીંગ પ્રા.લી. કંપનીના ડાયરેક્ટરો (૧) સંજીવકુમાર ઠાકુર (૨) અજય પ્રેમ સાગર અને (૩) સુરજીત ભોજસિંહ ચૈલસિંઘણી (તમામ રહે. નીલ સીધી એન્કલેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પ્લોટ નં ૪૮/૯ સેક્ટર ૧૪ વાશી મુંબઈ મહારાષ્ટ્ર) એ ભેગા મળી તા.૧૦/૦૨/૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન વસ્ત્રાપુર જજીસ બંગ્લા રોડ માનસી સર્કલ પાસે આઠમો માળ અભીશ્રી એડ્રોઈડ ૮૦૮ ખાતે કેસ્ટ કોમોપોઝીટ્સ એન્ડ પ્લાસ્ટીક્સ પ્રા.લી કંપની પાસેથી સેચ્યુરેટેડ પોલીએસ્ટર રેઝીનના માલનો ઓર્ડર મંગાવી બ્લોક થઇ ગયેલ બેન્ક એકાઉન્ટના ચેક આપી માલ ખરીદી માલના નાણા ૨,૨૩,૫૬,૬૨૪/- કંપનીને નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.જી.રબારી ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૬૨૪/૧૯

ઓઢવ: જયંતીભાઈ ગલાભાઈ વણકર (ઉ.વ.૩૪) (રહે. રબારી વસાહત ગેટ નંબર-૧ ઓઢવ) તા.૬/૪/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે જય કેમીકલ ફેક્ટરીની અંદર ફેસીલીટી-૦૧ ખાતે મજૂરી કામ કરતા હતા ત્યારે જય કેમીકલમાં સ્પ્રી કાવર અને બ્લેક આઇસ પ્લાન્ટની વચ્ચે નવા બનતા પ્લાન્ટની વચ્ચે આવેલ છતના બાકોરમાંથી ત્રીસેક કુટની ઉચાઇએથી પડી જતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી કે.આર.પરમાર ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટ: કૈલાશ પ્રતાપભાઈ વાસવણી (ઉ.વ.૪૦) (રહે. ચન્દ્રમા સોસાયટી ન્યુ જી વોડ કુબેરનગર) એ પત્ની રીસામણે હોઈ મનમાં લાગી આવતા તા.૭/૪/૧૯ બપોરના ૨/૪૫ વાગ્યાના સુમારે રીવરફ્રન્ટ દધીચીબ્રીજ નજીક નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી જશવંતભાઈ વિરમાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.